

Exam Seat No: _____

Enrollment No: _____

C.U.SHAH UNIVERSITY

Wadhwan City

Subject Code : 5LI02PCS3

Summer Examination-2014

Date: 13/06/2014

Subject Name:- Preservations and Conservations of Information Sources

Branch/Semester:- MLISc(GUJ)/II

Time:02:00 To 5:00

Examination: Regular

Instructions:-

- (1) Attempt all Questions of both sections in same answer book / Supplementary
- (2) Use of Programmable calculator & any other electronic instrument is prohibited.
- (3) Instructions written on main answer Book are strictly to be obeyed.
- (4) Draw neat diagrams & figures (If necessary) at right places
- (5) Assume suitable & Perfect data if needed

વિભાગ-૧

પ્રશ્ન-૧ ટુંકા પ્રશ્નો (બધા પ્રશ્નો ફરજીયાત છે.)

(૦૭)

- (૧) પ્રીઝર્વેશન એટલે શું ?
- (૨) ડીજીટાઇઝેશન એટલે શું ?
- (૩) ડીજીટાઇઝેશન માટેનાં જાણીતા ફાઇલ ફોર્મેટ કયા છે ?
- (૪) JPEG નું પુરૂ નામ જણાવો.
- (૫) આર્કાઇવીંગ એટલે શું ?
- (૬) PDF શું છે ?
- (૭) HTML નું પુરૂ નામ



પ્રશ્ન-૨

- (અ) ડીજીટલ પ્રીઝર્વેશનની ચર્ચા કરો (૦૫)
- (બ) પ્રીઝર્વેશનનાં ટેકનિકલ પાસાની ચર્ચા કરો. (૦૫)
- (ક) ફાઇલ કમ્પ્રેસન ટેકનોલોજી એટલે શું (૦૪)

અથવા

- (અ) કન્ઝર્વેશન માટેની સામગ્રી પસંદ કરવાની પ્રક્રિયા વર્ણવો (૦૫)
- (બ) પ્રીઝર્વેશન અને કન્ઝર્વેશનની પ્રક્રિયામાં ગ્રંથપાલની ભૂમિકાની ચર્ચા કરો (૦૫)
- (ક) પ્રીઝર્વેશનનાં સિદ્ધાંતો કયા છે ? (૦૪)

પ્રશ્ન-૩

- (અ) ગ્રંથાલય સામગ્રીને નુકશાનકર્તા આંતરીક અને બાહ્ય પરીબળોની ચર્ચા કરો. (૦૭)
- (બ) પ્રીઝર્વેશન અને કન્ઝર્વેશનની જરૂરીયાત અને તેના હેતુઓ જણાવો. (૦૭)

અથવા

પ્રશ્ન-૩

- (અ) પ્રીઝર્વેશન અને કન્ઝર્વેશનને અસરકર્તા વાતાવરણીય પરીબળો કયા છે ? (૦૭)
- (બ) દૂર્લભ સામગ્રીનું સંરક્ષણ કેવી રીતે કરશો ? (૦૭)



